

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૬/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૭ કેસ કરી, ૩૦ વ્યક્તિઓને ઝડપી, ૧૪૮ લીટર દેશી દારૂ, ૧૦૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૩ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૭ બિયર ટીન, ૧ રિક્ષા અને ૨ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૮,૨૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૯૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૦૭૭/૧૮

**નારણપુરા:** જાનકી વા/ઓફ દિપકુમાર યાજ્ઞીક (ઉ.વ.૩૨) (રહે. ટેનામેન્ટ નંબર-૧૧ પારસમણી સોસાયટી ન્યુ કર્મચારીનગરની બાજુમા રજાપાર્ક ઘાટલોડીયા) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૭/૬/૧૮ કલાક ૧૨/૩૦ થી બપોરના ૧/૦૦ વાગ્યા દરમિયાન નારણપુરા શિવાલીક કોમ્પલેક્ષમાં આવેલ એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં ૩૦ વર્ષના આશરાના અજાણ્યા પુરૂષે જાનકીબહેનની નજર ચુકવી એ.ટી.એમ કાર્ડ બદલી, પીન નંબર જાણી લઈ સી.જી.રોડ એ.ટી.એમ.માંથી કુલ રૂપિયા ૧૭,૦૦૦/- ઉપાડી લીધા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.એચ.ચૌધરી ચલાવે છે.

**કાઈમ બ્રાન્ચ:** પીન્કીબહેન વા/ઓફ સન્ની મોદી (ઉ.વ.૩૫) (રહે. સત્યસુર્ય કોમ્પલેક્ષ સતાધાર ક્રોસ રોડ સોલા ઘાટલોડીયા) એ તા.૭/૬/૧૮ નારોજ કાઈમ બ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૧૨/૨૦૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપી મોબાઈલ નંબર ૯૧૮૫૮૬૮૩૦૮૭૩ ના ધારકે પીન્કીબહેનના મોબાઈલ ફોન ઉપર કોલ કરી અનિરૂઢ્ધ શર્મા નામ જણાવી નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી પેન્કીબહેનના બેન્કના કેડીટકાર્ડ નંબર અને ઓટીપી નંબર જાણી લઈ રૂપિયા ૧,૨૪,૪૦૦/- ખાતામાંથી ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જે.એસ.ગેડમ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૦૭૮/૧૮

ઓઢવ: શંકરભાઈ રામભાઈ પટેલ (રહે.અમરનાથવિલા સુર્યમ એલીગન્સની પાછળ રીંગરોડ ઓઢવ) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૬/૬/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૭/૬/૧૮ સવારના ૫/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના બાથરૂમના બારીના કાચ ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાની ચેઈન કિમત રૂપિયા ૩૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૪૮,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૮,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.જે.ચૌહાણ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૦૭૯/૧૮

સોલા હાઈકોર્ટ: ભરતભાઈ દશરથભાઈ પટેલ (ઉ.વ.૪૫) (રહે. પંચામૃત બંડ્લોઝ વિભાગ-૧ સીમ્સ હોસ્પિટલ સામે સાયન્સ સીટી રોડ સોલા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૬/૬/૧૮ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે ગોતા ખાતે વંદેમાતરમ રોડ ઉપર આવેલ ઉમાપતી સેલ્સ એજન્સીના આગળ પાર્ક કરેલ ટ્રકના કેબીનમાંથી અજાણી વ્યક્તિ પોતાના ટ્રકના ડ્રાયવરની નજર ચુકવી રોકડ રૂપિયા ૯૩,૬૫૧/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.આર.ગઢવી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૦૮૦/૧૮

સરદારનગર:(૧) મીસનાબહેન રાહુલભાઈ પરમાર (રહે. લક્ષ્મીનગર સોસાયટી શર્મા કંપની સામે સુતરના કારખાના નજીક નરોડા રોડ) એ અગમ્ય કારણસર તા.૬/૬/૧૮ રાતના ૧૦/૩૦ વાગ્યાથી ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

(૨) વાલીબહેન દિનેશભાઈ પરમાર (રહે. રમેશદત કોલોની મહાકાળી મંદીરની બાજુમા સરદારનગર) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૮ કલાક ૧૦/૦૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

દાણીલીમડા: કૌસરબાનુ ડો/ઓ મહમદ ઇબ્રાહિમભાઈ શેખ (ઉ.વ.૧૫) (રહે. હનીફભાઈ ટેકરાવાળીની ચાલી ગોષિયા કોલોનીની આગળ દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૮ બપોરના ૧૨/૧૫ થી ૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ. શ્રી વાચ.કે.ગોહિલ ચલાવે છે.

કાગડાપીઠ: મેહુલભાઈ મગનભાઈ દુલેરા (ઉ.વ.૨૮) (રહે. છીપ્પાની ચાલી મજુરગામ ચાર રસ્તા પાસે ગીતા મંદીર) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૮ બપોરના ૩/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી આશીષભાઈ લક્ષ્મણભાઈ ચલાવે છે.

નારોલ: રાહુલભાઈ સ/ઓ ચંદ્રકાંતભાઈ માંડગે (ઉ.વ.૩૦) (રહે. અલીફનગર સોસાયટી ચિરાગ રેસિડેન્સી સામે વટવા કેનાલ પાસે નારોલ) એ અગમ્ય કારણસર તા.૭/૬/૧૮ કલાક ૧૨/૦૦ પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મેલાભાઈ સોમાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.